



March 2, 2021

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Advertisement in Newspapers under Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, we attached herewith Newspaper Cutting for the advertisement published in 'Gujarat Guardian' and 'The Financial Express' publication dated 11/02/2021 in the matter of **Publication of Unaudited Financial Results** for the quarter and nine months ended on 31st December, 2020.

Kindly update this information on your website for investors/general public.

Thanking you.

For, Shahlon Silk Industries Limited

A handwritten signature in black ink, appearing to read 'Hitesh K. Garmora', enclosed within a hand-drawn circular scribble.

Hitesh K. Garmora
Company Secretary

Reg. off : 91, G.I.D.C. Khatodara,
Behind Sub-Jail, Ring Road,
Surat-395 002, Gujarat, INDIA

Tel. : +91 261 2635551 - 53 & 57
+91 261 4190200 / 291
Fax : +91 261 2635552

CIN : L17120GJ2008PLC053464
E-mail : Info@shahlon.com
Web : www.shahlon.com

સુરત શહેરમાં અકસ્માતોની વણઝાર

પુણામાં કાળબનીને ધસી આવેલી ખાનગી લકઝરી બસે અડફ્ટે લેતાં ગોડાદરાના શિક્ષકનું કરુણ મોત

સુરત, તા. ૧૦
પુણા પાટિયા પાતના કાંગારુ સર્કલ નજીક આજે વહેલી સવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો, લકઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી બેલેન્સ ગુમાવતા આગળ જઈ રહેલા શાકભાજી ભરેલા ટેમ્પાને ટક્કર માર્યા બાદ પોતાનું નિર્ધેન ગુમાવી બસને ડિવાઈડર સાથે ધડાકાભર અથડાવી દીધી હતી, સર્જાયેલા અકસ્માતના પગલે પુણા પાટિયા પાસે બસના વ્હીલ નીચે કચડાઈ જતા ઉભેલા શિક્ષકનું મોત નિપજ્યુ હતું. ઉપરાંત ટેમ્પામાં બેઠેલા માતા પુત્રને ઈજા થતા સારવાર માટે સ્મીમર હોસ્પિટલમાં ખસેડાયા હતા. દોડી આવેલ પોલીસ અને ફાયરના જવાનોએ બસના વ્હીલ નીચે ફસાયેલા શિક્ષકનું મૃતદેહને જહમત ઉઠાવેને બહાર કાઢ્યો હતો.



કાંગારુ સર્કલ નજીક વહેલી સવારે બેફામ લકઝરી ચાલકે ટેમ્પોને અડફ્ટે લીધા બાદ ડિવાઈડર નજીક શાકભાજી ભરેલા ટેમ્પાને કચડાઈ જતા શિક્ષકનું મોત નિપજ્યુ હતું. ઉપરાંત ટેમ્પામાં બેઠેલા માતા પુત્રને ઈજા થતા સારવાર માટે સ્મીમર હોસ્પિટલમાં ખસેડાયા હતા. દોડી આવેલ પોલીસ અને ફાયરના જવાનોએ બસના વ્હીલ નીચે ફસાયેલા શિક્ષકનું મૃતદેહને જહમત ઉઠાવેને બહાર કાઢ્યો હતો.

આવ્યા હતા, અને પુણા પાટિયા ઉપર બસની રાહ જોતા ઉભેલા હતા, ત્યારે ઝું સાઈ રામ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પુણા પાટિયા સીએનજી કમ્પાસે આગળ જઈ રહેલા એક ટેમ્પાને ટક્કર મારી હતી. ત્યાર બાદ તેને સ્ટેરિંગ ઉપર કાબુ રાખી નહીં હતો, અને ડિવાઈડર સાથે બસ અથડાવ હતી. સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં શિક્ષક ભરત લાડુમોર ગ્રાઉવર સાઈડના વ્હિલ નીચે ફસાઈ જવાને કારણે કચડાઈ જતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. જ્યારે સરદાર માર્કેટમાંથી શાકભાજી ભરીને ટેમ્પામાં બેસીને માતા - પુત્ર રશીદાબેન ઈસ્માઈલ શેખ (ઉ.વ.૫૫) અને રશીદ ઈસ્માઈલ શેખ (ઉ.વ.૩૮) બંને રહે-હેસ્તાન આવસ ઈજા પામ્યા હતા. અકસ્માતને પગલે સ્થળ ઉપર અફડાતફારી સર્જાઈ હતી. અકસ્માતની ઘટના અંગે જાણ કરવામાં આવતા પુણા પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચીને ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે સ્મીમર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે શિક્ષક વ્હીલ નીચે એવી રીતે ફસાઈ ગયા હતા કે તેમના મૃતદેહને બહાર કાઢવો મુશ્કેલ થયું હતું. મૃતદેહને બહાર કાઢવા માટે ફાયરના લાકઝરીને મદદ લઈ બસના વ્હીલ નીચે બહાર કાઢી પોલીસને સોંપી હતો. યુવાન શિક્ષક ભરત લાડુમોરનું મોત નિપજતાં તેના પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાવ ગયું હતું.

ગોડાદરા પાતેની શિવ પાર્ક સોસાયટીમાં રહેતા ભરત રામજી લાડુમોર (આહીર) (ઉ.વ.૩૧) મુળ રહે, સણાસરી, જી.ગીર સોમનાથ પરિવારમાં પત્ની અને બે સંતાનો સાથે વસવાટ કરી રહ્યા હતા જેઓ વ્યારા નજીકના કેળકૂઈ ગામે આવેલ પ્રથમકક્ષ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા, આજે સવારે તેઓ ઘરેથી કેળકૂઈ ગામે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. ઘર પાસેથી રિક્ષામાં બેસી પુણા પાટિયા સુધી

એર બેગ લિફ્ટિંગ દ્વારા ફાયર બ્રિગેડે શિક્ષકનો મૃતદેહ બહાર કાઢ્યો

લકઝરી બસના ચાલકની બેદરકારીના કારણે અકસ્માતમાં નિર્દોષ શિક્ષકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બસની ડ્રાઈવર સાઈડના વ્હીલ નીચે શિક્ષક ભરત લાડુમોર હતા. પોલીસે તેમનો મૃતદેહ બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ લોખંડના પતરામાંથી મૃતદેહ બહાર નીકળ્યો ન હતો. અંતે પોલીસે ફાયર બ્રિગેડને બોલા કરી હતી. ફાયર ઓફિસર દિનુ પટેલ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તે પછી ફાયરના જવાનોએ ત્રણ જેટલી એર લિફ્ટિંગ બેગ અને જેકની મદદથી વ્હીલ નીચે ફસાયેલા શિક્ષકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

અડાજણના વકીલ સાથે ૧.૬૦ લાખની ઇતરપિંડી

સુરત, તા. ૧૦
અડાજણ એલ.પી.સવાણી રોડ પર આવેલા આત્મનપાર્ક રોડ ઇલેક્ટ્રીકલ એડવાઈઝર અમિષ ચંદ્રકાંત મહેતા એલ.પી. સવાણી રોડ બુલ્ડ સેવર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. અમીષ મહેતા ગઈ તા. ૭ ફેબ્રુઆરીના રોજ સાંજે તેના કેન્સલીન ટેમ્પેલસના મ્યુચ્યુઅલકંપના ખાતામાં ટ્રાન્ઝેક્શન એક્સેસ મેગવવા માટે ગુગલ સાઈટ પરથી એક મોબાઈલ નંબર મેળવ્યો હતો. અને તે મોબાઈલ નંબર પર ફોન કરી મ્યુચ્યુઅલકંપમાં ટ્રાન્ઝેક્શન એક્સેસ કરવાની વાત કરી હતી. સામેવાળા બેજાબાજે મોબાઈલમાં ગુગલ પ્લેસ્ટોરમાંથી ક્લીક શેર અને ટીમયુઅર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. અને તેમાં આવેલા આઈ.ડી. નંબર માગ્યો હતો. જેથી અમીષ મહેતાએ એપ્લિકેશન ડાઉનલોડ કરી આઈ.ડી. નંબર આપ્યો હતો. ત્યારબાદ બેજાબાજે અમીષ મહેતાને મ્યુચ્યુઅલકંપમાં ટ્રાન્ઝેક્શન એક્સેસ મેગવવા માટે ખાતામાંથી તેમની કંપનીમાં એક રૂપિયાનું ચાર્જ પેટાચલાયું હતું. અમીષ મહેતાએ તેના એસ.બી.આઈ બેંકના ખાતામાંથી નેબેકેટિંગ મારફતે લોગ ઈન કરતા મોબાઈલમાં એ.ટી. પી આપ્યો હતો. અને થોડાવારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂપિયા ૧.૬૦ લાખ નોવાપે સોલ્યુશન પ્રા.લી. ના ખાતામાં ટ્રાન્ઝેક્શન થયા હોવાની મેસેજ વકીલ અમિષ મહેતાના ફોન પર આવતા તે ચોંક્યા હતા અને પોતે ઇતરાઈ ગયા હોવાનું જણાતા તાત્કાલિક અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અડાજણના આશાસ્પદ યુવક હર્ષ પ્રજાપતિનું અકસ્માતમાં મોત: મિત્ર પ્રણવ શિમ્પી ગંભીર

સુરત, તા. ૧૦
સ્પોર્ટ્સ બાઉન્ડ લઈને આજે સાંજે ડુમસ શહેરના ડુમસ રોડ તરફથી સ્પોર્ટ્સ તરફથી પરત આવી રહ્યા હતા. બાઉન્ડ લઈને પસાર થતાં બે કિશોરોની સાથે પીપલોદ કારગીલ ચોક પાસે કાર સાથે અકસ્માતમાં સર્જાયો હતો.

સ્પોર્ટ્સ બાઉન્ડ લઈને આજે સાંજે ડુમસ શહેરના ડુમસ રોડ તરફથી સ્પોર્ટ્સ તરફથી પરત આવી રહ્યા હતા. જ્યાં પીપલોદ કારગીલ ચોક નજીકના વિજય સેલ્સ સામે કાર જઈ પ આરજી ૪૪૫૩ સાથે બાઉન્ડનો સર્જાયો હતો. અકસ્માતમાં

મિલકત લે-વેચ માટે

હોજીવાલા હુઆઈડીસી સચીન ઈન્ડસ્ટ્રીયલમાં પ્લોટ લે-વેચ તથા ભાડે માટે 22x100 sf, 20x100 sf, 16 x 83.6 sf 756, 1484, 3612, 7308 s. m, સતીષ શાહ, દુકાન નં-6, હોજીવાલા ગેટ નં-2, રોડ નં-10, સચીન, સુરત, 9825127450, 9898027450

શાહલોન સીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ લિમિટેડ

કોર્પોરેટ ઓફિસ: ત્રીજા માળ, દાદર રોડ, સુરત, ગુજરાત, સુરત ૩૬૫૦૦૨
CIN: L17120GJ2008PLC053464
ટેલી નં: ૨૬૧-૨૬૧-૪૨૯ ૨૦૨૦ ફેક્સ: ૨૬૧-૨૬૧-૨૬૩ ૫૫૫૦ Website: www.shahlon.com

ક્રમ	વિગત	ગ્રાહકોની સંખ્યા	માસ માટેની સંખ્યા	સરેરાશ વેચાણ	સરેરાશ વેચાણ	સરેરાશ વેચાણ
1	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
2	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
3	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
4	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
5	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
6	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
7	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
8	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
9	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020
10	વેબસાઇટ	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020	31.12.2020

જે તેના મિત્રો સાથે વેચુ વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા ગયા હતા. ત્યારે પરત ફરતા અકસ્માતનો ભોગ બનતા પરિવારમાં શોકનું વાતાવરણ ફેલાવ ગયું છે. હર્ષના પિતા સીજનલ ધંધો કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અનાવમાં બંને યુવાનો રસ્તા ઉપર પટકાતા ગંભીર ઈજા પામ્યા હતા. જેમાં હર્ષ પ્રજાપતિનું મોત નિપજ્યુ હતું. જ્યારે પ્રણવને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે. બંને મિત્રો સ્કૂલના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળે છે. અકસ્માતનો ભોગ બનેલ હર્ષ ધીરજ અગિયારમાં અભ્યાસ કરી રહ્યો હતો.

SARLA PERFORMANCE FIBERS LIMITED

CIN: L31909DN1993PLC000056
Regd. Office: Survey No. 69/1/4, Amlipiparia Industrial Estate, Sakinaka - 396 230, (U.T. of Dadra & Nagar Haveli).
Tel: 022 22834116, Fax: 022 22851728, Website: www.sarfalfibers.com
Email: info@sarfalfibers.com

સુરત જિલ્લા ભાજપ મહામંત્રી પદથી ભાવેશ પટેલનું રાજીનામું

સુરત: બારડોલી તાલુકાની વાંદાનેર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી થતા ભાવેશ પટેલે ભાજપ સુરત જિલ્લા મહામંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. ભાવેશ પટેલે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામુંના પત્ર મોકલી આપ્યો હતો, તમનેજ લખ્યું હતું કે, વાંદાનેર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી થતા ચૂંટણી લડવાનું નક્કી થયું હોય પોતે સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપે છે.

સુરત શાખા : ૩જો માળ, ન્યુ વિંગ, સિદ્ધી શોપીંગ કોમ્પ્લેક્સ, સિદ્ધી લાઈટ રોડ, શિવપુત્ર શોપીંગ સેન્ટરની સામે, સુરત - ૩૬૫૦૦૭

કંબળ નોટીસ (રૂલ ૮૧) મુજબ સ્થાયર મિલકત માટે	નોટીસની તારીખ	નોટીસની તારીખ	નોટીસની તારીખ
શ્રી યુગલભાઈ મહાપાત્ર/શ્રી યુગલભાઈ મહાપાત્ર અને શ્રીમતી જયશાંતી કેશુભાઈ કલેશા	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી નરેન્દ્ર મહુરજા/શ્રી સિદ્ધાંત સિંઘ અને શ્રીમતી મુશ્કીદેવી નરેન્દ્ર સિંઘ	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી દિનેશ બેરસાની પટેલ અને શ્રીમતી મનોરમા રામચંદ્ર	૧૧.૦૬.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી ગોરંગભાઈ મનુજીભાઈ મનુજીભાઈ અને શ્રીમતી સુવર્ણબાઈ એમ. સુવર્ણબાઈ	૧૪.૦૯.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

સુરત શાખા : ૩જો માળ, ન્યુ વિંગ, સિદ્ધી શોપીંગ કોમ્પ્લેક્સ, સિદ્ધી લાઈટ રોડ, શિવપુત્ર શોપીંગ સેન્ટરની સામે, સુરત - ૩૬૫૦૦૭

કંબળ નોટીસ (રૂલ ૮૧) મુજબ સ્થાયર મિલકત માટે	નોટીસની તારીખ	નોટીસની તારીખ	નોટીસની તારીખ
શ્રી યુગલભાઈ મહાપાત્ર/શ્રી યુગલભાઈ મહાપાત્ર અને શ્રીમતી જયશાંતી કેશુભાઈ કલેશા	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી નરેન્દ્ર મહુરજા/શ્રી સિદ્ધાંત સિંઘ અને શ્રીમતી મુશ્કીદેવી નરેન્દ્ર સિંઘ	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી દિનેશ બેરસાની પટેલ અને શ્રીમતી મનોરમા રામચંદ્ર	૧૧.૦૬.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી ગોરંગભાઈ મનુજીભાઈ મનુજીભાઈ અને શ્રીમતી સુવર્ણબાઈ એમ. સુવર્ણબાઈ	૧૪.૦૯.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

કોર્પોરેટ ઓફિસ: ૨૦૧, સહેલ પોલ્ડ-૧, શામલા વિક્રમ બેંક પાસે, સહેલ રોડ, વાંદાવાલા સાંકેટગુજ (૪), મુંબઈ ૪૦૦૦૫૭
સુરત શાખા : ૩જો માળ, ન્યુ વિંગ, સિદ્ધી શોપીંગ સેન્ટરની સામે, સુરત - ૩૬૫૦૦૭

કંબળ નોટીસ (રૂલ ૮૧) મુજબ સ્થાયર મિલકત માટે	નોટીસની તારીખ	નોટીસની તારીખ	નોટીસની તારીખ
શ્રી યુગલભાઈ મહાપાત્ર/શ્રી યુગલભાઈ મહાપાત્ર અને શ્રીમતી જયશાંતી કેશુભાઈ કલેશા	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી નરેન્દ્ર મહુરજા/શ્રી સિદ્ધાંત સિંઘ અને શ્રીમતી મુશ્કીદેવી નરેન્દ્ર સિંઘ	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી દિનેશ બેરસાની પટેલ અને શ્રીમતી મનોરમા રામચંદ્ર	૧૧.૦૬.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી ગોરંગભાઈ મનુજીભાઈ મનુજીભાઈ અને શ્રીમતી સુવર્ણબાઈ એમ. સુવર્ણબાઈ	૧૪.૦૯.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ

કોર્પોરેટ ઓફિસ: ૨૦૧, સહેલ પોલ્ડ-૧, શામલા વિક્રમ બેંક પાસે, સહેલ રોડ, વાંદાવાલા સાંકેટગુજ (૪), મુંબઈ ૪૦૦૦૫૭
સુરત શાખા : ૩જો માળ, ન્યુ વિંગ, સિદ્ધી શોપીંગ સેન્ટરની સામે, સુરત - ૩૬૫૦૦૭

કંબળ નોટીસ (રૂલ ૮૧) મુજબ સ્થાયર મિલકત માટે	નોટીસની તારીખ	નોટીસની તારીખ	નોટીસની તારીખ
શ્રી યુગલભાઈ મહાપાત્ર/શ્રી યુગલભાઈ મહાપાત્ર અને શ્રીમતી જયશાંતી કેશુભાઈ કલેશા	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી નરેન્દ્ર મહુરજા/શ્રી સિદ્ધાંત સિંઘ અને શ્રીમતી મુશ્કીદેવી નરેન્દ્ર સિંઘ	૨૭.૦૧.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી દિનેશ બેરસાની પટેલ અને શ્રીમતી મનોરમા રામચંદ્ર	૧૧.૦૬.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧
શ્રી ગોરંગભાઈ મનુજીભાઈ મનુજીભાઈ અને શ્રીમતી સુવર્ણબાઈ એમ. સુવર્ણબાઈ	૧૪.૦૯.૨૦૨૦	૦૫.૦૨.૨૦૨૧	૧૨.૦૨.૨૦૨૧

સોલોનિયમ

આથી અમો નીચે સહી/અંગૂઠાનું નિશાન કરનાર સોમભુભાઈ ગાંવજીભાઈ વરડી, ડી. આ. વ. - ૫૩, ડે- પેટી, રહે. અંકલાલ, વાંદાવાલા ડાંગરિયા, તા. વાંસદા, જી. નવસારી ના તે મારા હિન્દુ ધર્મના સોલો ઉપર પ્રતિષ્ઠા લઈ બેઠક કંચુ છું કે, હું સોલોનિયમ કરનારનાઓ કાચમી મોવે. અંકલાલ, વાંદાવાલા ડાંગરિયા, તા. વાંસદા, જી. નવસારી ના રહીશ છીએ. અમો સોલોનિયમ કરનારની સગી બહેન મનકીબેન ગાંવજીભાઈ વરડી ના મોજે રૂમવા મુકામે ઠાકોટવાર બાબતનાર ગાયકવાડ નામો સાથે ઘણા થયેલા અને તેમનો રૂમવા મુકામે ય તેમના ઘણી સાથે રહેતા હતા. તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ રૂમવા મુકામે ય પેટી કામ માટે ગયેલા હતા. ત્યાર બાદ તેઓ રૂમવા ગામેથી ય ક્યાંક ગુમ થઈ ગયેલા છે. તેમની શોધખોળ સગા હવાલોને ત્યાં અને આજુબાજુ ગામમાં કરતેલી પરંતુ તેઓ મળી આવેલ નથી અમો સોલોનિયમ કરનારની સગી બહેન મનકીબેન ઠાકોટવાર બાબતનાર ગાયકવાડ નામો સાથે થયેલ તે બાબતનું આ સોલોનિયમ કરનારની રૂમર પડેલ છે. ઉપરોક્ત સોલોનિયમમાં જણાવેલી તમામ મજબૂત હકીકતો મારા બાબવા તથા માનવા મુજબ ખરી છે. ખોટું સોલોનિયમ કરતું એ ફોજદારી ગુનો બને છે. જેની મને ખબર છે.

તા. ૧૦/૦૨/૨૦૨૧
વાંસદા.

નિવિદા નં-૩૨ સને ૨૦૨૦-૨૧

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ વલસાડ

ગુજરાત રાજ્યના પંચાયતો વતી કાર્યાલયકારી પંચાયત (પા.મ.) વિભાગ-વલસાડ કોન. નં. (૦૨૬૩૨-૨૫૨૬૪)ની કોરોનેચી ઉપરોક્ત કામની નિવિદાની ખરોટાટ આવવામાં આવેલ જેમાં સંબંધ વધારા વધારા પાડવામાં આવે છે. જેમાં તમામ ટેન્ડરની ઓળખ હાલ સમીક્ષાને લઈ લેવા તારીખ-૨૪/૦૨/૨૦૨૧ રાખવામાં આવેલ છે. જેની લાગુતા-વધારા વધારા-૨૪/૦૨/૨૦૨૧ નોંધ લેવા તારીખ-૨૪/૦૨/૨૦૨૧ રાખવામાં આવેલ છે.

નં. માહિતી/વલસાડ/સુ./૧૬/૦૨/૨૦૨૧

નિવિદા નં-૩૨ સને ૨૦૨૦-૨૧

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ વલસાડ

ગુજરાત રાજ્યના પંચાયતો વતી કાર્યાલયકારી પંચાયત (પા.મ.) વિભાગ-વલસાડ કોન. નં. (૦૨૬૩૨-૨૫૨૬૪)ની કોરોનેચી ઉપરોક્ત કામની નિવિદાની ખરોટાટ આવવામાં આવેલ જેમાં સંબંધ વધારા વધારા પાડવામાં આવે છે. જેમાં તમામ ટેન્ડરની ઓળખ હાલ સમીક્ષાને લઈ લેવા તારીખ-૨૪/૦૨/૨૦૨૧ રાખવામાં આવેલ છે. જેની લાગુતા-વધારા વધારા-૨૪/૦૨/૨૦૨૧ નોંધ લેવા તારીખ-૨૪/૦૨/૨૦૨૧ રાખવામાં આવેલ છે.

નં. માહિતી/વલસાડ/સુ./૧૬/૦૨/૨૦૨૧

MAPRO INDUSTRIES LIMITED

CIN: L70101MH1973PLC0206701
 Regd. Office: 505, Corporate Corner, 5th Floor, Sunder Nagar, Malad (W), Mumbai - 400 064
 Tel No: +91-28-28725764; Email Id: info@maproindustries.com; website: maproindustries.com

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st December, 2020

(Rs. In Lacs except earning per share)

Sr. No.	Particulars	Quarter Ended	Nine month	Quarter
		December 31, 2020	December 31, 2020	Ended December 31, 2019
		Un-Audited	Un-Audited	Un-Audited
1	Total Income from Operations	-	-	-
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	18.16	(17.48)	4.36
3	Net Profit/(Loss) before tax (after Exceptional and/or Extraordinary items)	18.16	(17.48)	4.36
4	Net Profit/(Loss) after tax (after Exceptional and/or Extraordinary items)	18.16	(17.48)	4.36
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	18.16	(17.48)	4.36
6	Equity Share Capital (Face Value Rs. 10/- Per Share)	838.89	838.89	838.89
7	Reserves (Excluding Revaluation Reserves)	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
	(a) Basic	0.22	(0.21)	0.05
	(b) Diluted	0.22	(0.21)	0.05

Notes:

- The above results for the Quarter and nine month Ended December 31, 2020 have been reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their Meeting held on February 9, 2021. The Statutory auditors have carried out a "Limited Review" of above results.
- The above is an extract of the detailed format of Quarter and half year ended Un-Audited Financial Results filed with the BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the said Quarterly Un-Audited Financial Results are available on the Stock Exchange website www.bseindia.com and on the company's website www.maproindustries.com.

For and on behalf of Board of Directors
 Sd/-
Umesh Kumar Kanodia
 Managing Director
 (DIN: 00577231)

Place: Mumbai
 Date: February 9, 2021

Capgemini

LIQUIDHUB INDIA PRIVATE LIMITED

CIN: U72200MH2003PTC340967
 Registered Office: 2nd Floor, A Block, A wing, IT 1 and IT 2 Airoli Knowledge Park, Thane Belapur Road, Airoli Navi Mumbai Thane 400708, Maharashtra, India Tel No.: 022 71444283

NOTICE OF HEARING OF THE COMPANY SCHEME PETITION

Before The National Company Law Tribunal
 In the matter of Scheme of Amalgamation between
 Liquidhub Analytics Private Limited and Liquidhub India Private Limited
 with Capgemini Technology Services India Limited
 Company Scheme Petition no. 1092 of 2020 in
 Company Scheme Application No. 1042 of 2020
 U/s 230-232 of the Companies Act, 2013.

Take notice that a Company Scheme Petition under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 and rules framed there under for an order sanctioning the Scheme of Amalgamation of Liquidhub Analytics Private Limited and Liquidhub India Private Limited with Capgemini Technology Services India Limited and their respective Shareholders was presented by the Petitioner Companies on 21 January 2021 and was admitted by Hon'ble National Company Law Tribunal, Mumbai Bench ("NCLT") on 21 January 2021. The said Company Scheme Petition is fixed for final hearing and disposal on 11 March 2021.

Copies of the Company Scheme Petition no. 1092 of 2020 filed with the NCLT along with the Order approved/allowed by NCLT, can be obtained free of charge at the registered offices of the respective Petitioner Companies and/or at the office of the Advocates, ALMT Legal, Advocates & Solicitors, located at 1104A Raheja Chambers, Free Press Journal Marg, Nariman Point, Mumbai 400021. If you are desirous of making any representations/objections to the said Company Scheme Petition, we request you to send such representations/objections to the office of the Advocates for the Petitioner Companies (with the grounds of opposition/representation) no later than 2 days before date fixed for hearing. If no representation/objection is received within the stated period, it will be presumed that there are no representation/objections to the proposed Scheme of Amalgamation and the Petition.

For Liquidhub India Private Limited
 Sd/-
Sujit Sircar (DIN 00026417)
 Director

Date : 8 February 2021

WALCHANDNAGAR INDUSTRIES LTD.

Seth WALCHAND HIRACHAND

Regd. Office: 3, Walchand Terraces, Tardeo Road, Mumbai - 400 034.
 CIN : L74999MH1908PLC000291
 Tel No. : (022) 23612195/96/97 Fax : (022) 23634527.
 E - mail : investors@walchand.com, Website: www.walchand.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2020

(₹ In Lacs (Except for Per Share data))

Sr. No.	Particulars	Quarter Ended		
		31-12-2020	31-12-2019	31-12-2020
		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations (net)	11,035	7,966	26,176
2	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional items)	(771)	(1,412)	(4,175)
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional items)	(771)	(2,391)	(4,175)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional items)	(771)	(2,391)	(4,175)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income after tax]	(785)	(2,421)	(4,237)
6	Equity Share Capital (Face Value of Rs 2/- each)	761	761	761
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-
8	Earning Per Share (of Rs 2/- each) (for continuing and discontinued operations)			
	(a) Basic :	(2.02)	(6.28)	(10.97)
	(b) Diluted :	(2.02)	(6.28)	(10.97)

Notes:

- Inventory includes work in progress of Rs. 2194.21 Lakhs in respect of orders which have been cancelled / put on hold. The Company is of the opinion that no provision is required to be made as on December 31, 2020 as this stock will be either liquidated or diverted to other projects.

For Walchandnagar Industries Ltd.
 Sd/-
CHIRAG C. DOSHI
 MANAGING DIRECTOR & CEO

Place : Mumbai
 Date : February 10, 2021

A Tradition of Engineering Excellence

Note: The above is an extract of the detailed format of Quarter ended on 31st December, 2020 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results of the Quarter ended is available on the Stock Exchanges website at www.bseindia.com and www.nseindia.com and on the Company's website at www.walchand.com.

GLANCE FINANCE LIMITED

CIN : L65920MH1994PLC081333
 5, Kitab Mahal, 192, Dr.D.N.Road, Fort, Mumbai - 400001, Email : glance@glancefin.com
 Website : glancefinance.com, Tel No : 4066 6666/67, Fax no : 4066 6670

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED DECEMBER 31, 2020

(Rs. In Lacs) Except EPS

Sr. No.	Particulars	Quarter Ended	Nine Month	Quarter
		31-12-2020	31-12-2020	31-12-2019
		Reviewed	Reviewed	Reviewed
1	Total Income From Operations	117.76	322.72	36.28
2	Net Profit/(Loss) for the period (Before tax, exceptional and/ or extraordinary items)	91.31	189.64	21.05
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	91.31	189.64	21.05
4	Net Profit/(Loss) for the period After tax after exceptional and / or extraordinary items)	51.72	122.06	3.32
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	122.55	420.12	30.16
6	Equity Share Capital	227.52	227.52	227.52
7	Earnings Per Share (of Rs.10/- each)			
	Basic :	2.29	5.41	0.15
	Diluted :	2.29	5.41	0.15

Notes:

- The above unaudited financial results have been reviewed by the Audit Committee and have been approved by the Board of Directors at their respective meetings held on 10th February, 2021 pursuant to Regulation 33 of SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations 2015 (as amended). The above results have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under Section 133 of the Companies Act, 2013, read together with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended).
- The Statutory Auditors of the Company have carried out a Limited Review of the results for the quarter/Nine Month ended December 31, 2020 and have issued a qualified review report (refer para no.4 of Limited Review Report).
- The Company is primarily engaged in the Finance & Investment activities and all other activities revolve around the main business of the Company. Further, all activities are conducted within India and as such there is no separate reportable segment, as per the Ind AS 108 "Operating Segments" specified under Section 133 of the Act.
- Due to COVID related slowdown, financial numbers during the quarter have been impacted.
- Provision for Gratuity and Leave encashment is made on estimated basis.
- Previous period's / Year's figures have been regrouped / rearranged wherever necessary.

For Glance Finance Limited
 Sd/-
Narendra Karnavat
 (Director)
 (DIN : 00027130)

Place : Mumbai
 Date : 10th February, 2021

TOYAM INDUSTRIES LIMITED

(Formerly Ojas Asset Reconstruction Company Limited)
 CIN: L7410MH1985PLC265384
 Regd. Office: 503, Shri Krishna Building, Opp. Laxmi Industrial Estate, Link Road, Andheri (w), Mumbai, Maharashtra-400036, Tel.: 022-67425111
 Email: info@toyamindustries.com Website: www.toyamindustries.com

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31.12.2020

(In Lakhs)

Particulars	Quarter Ended		Nine Months		Year Ended	
	31.12.2020	30.09.2020	31.12.2020	31.12.2020	31.03.2020	31.03.2020
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
Total Revenue	27.57	23.08	80.75	209.02		
Profit/(Loss) before Tax and Exceptional items	4.51	4.83	14.33	10.40		
Profit/(Loss) from ordinary activities before tax	4.51	4.83	14.33	10.40		
Net Profit/(Loss) for the period	6.23	4.86	17.77	10.64		
Total Comprehensive Income/(Loss)	6.23	4.86	15.48	(16.03)		
Paid-up Equity Share Capital, FV Rs. 1/-	2,124.90	2,124.90	2,124.90	2,124.90	2,124.90	
Earning Per share (EPS) *Not annualised						
(a) Basic	0.00	0.00	0.01	0.01		
(b) Diluted	0.00	0.00	0.01	0.01		

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31.12.2020

(In Lakhs)

Particulars	Quarter Ended		Nine Months		Year Ended	
	31.12.2020	30.09.2020	31.12.2020	31.12.2020	31.03.2020	31.03.2020
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited	Audited
Total Revenue	27.57	23.08	80.75	223.51	209.02	
Profit/(Loss) from ordinary activities before tax	4.51	4.96	26.35	14.46	97.16	10.57
Net Profit/(Loss) for the period	6.23	4.99	26.01	17.90	98.20	10.81
Total Comprehensive Income/(Loss)	6.23	4.99	15.51	15.61	74.49	(15.86)
Paid-up Equity Share Capital, FV Rs. 1/-	2,124.90	2,124.90	2,124.90	2,124.90	2,124.90	
Earning Per share (EPS) *Not annualised						
(a) Basic	0.00	0.00	0.01	0.01	0.05	0.01
(b) Diluted	0.00	0.00	0.01	0.01	0.05	0.01

Notes:

- The above unaudited consolidated and standalone financial results were reviewed by Audit Committee and the same has been approved by the Board of Directors at their meeting held on Tuesday, 9th February, 2021.
- Figures for the Previous period have been regrouped/re-classified to confirm to the figures of the current period.
- This Financial statement has been prepared in accordance with the Companies Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and Companies (IAS) Amendment Rules, 2016 and other recognised accounting practices and policies to the extent applicable.
- As the consolidation is applicable from the last quarter of previous financial year, disclosure of figures for the quarter ended December 31, 2019 is not applicable in unaudited consolidated Financial result.
- The above is an extract of the detailed format of Quarterly and Nine Months ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015. The full format of the quarterly and nine months ended financial results are available on the Stock Exchange website (www.bseindia.com & www.mseil.in) and also on the Company's website www.toyamindustries.com.

FOR Toyam Industries Limited
 Sd/-
Mohamed Ali Budhwani
 Managing Director
 DIN: 01976253

Place: Mumbai
 Date: 09/02/2021

Tulasee Bio-Ethanol Ltd.

Regd. Off. & Fact: Plot No. 41/3 & 41/5, Village Lohop, Lohop Chowk Rd., Tal. Khalapur - 410 202, Dist. Raigad, Maharashtra
 E-mail : tulaseebio@gmail.com CIN : L2415MH11986PLC048126

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2020

(₹ In Lakhs)

Particulars	Year to date			
	Quarter ending	figures for	Quarter ending	
	31/12/2020	31/12/2020	31/12/2019	
		Unaudited	Unaudited	Unaudited
Total Income from operations	-	-	-	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(1.60)	(12.85)	(4.68)	
Net Profit / (Loss) for the period before Tax, (after Exceptional and/or Extraordinary items)	(1.60)	(12.85)	(4.68)	
Net Profit / (Loss) for the period After Tax, (after Exceptional and/or Extraordinary items)	(1.60)	(12.85)	(4.68)	
Total comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after Tax) and other Comprehensive Income]	(1.60)	(12.85)	(4.68)	
Equity Share Capital (Face Value Rs. 10/- each)	583.60	583.60	583.60	
Earnings per equity Share (of Rs.10/- each) (Not annualised)	-	-	-	
(a) Basic	-	-	-	
(b) Diluted	-	-	-	

Notes:

- The above is an Extract of the detailed format of results for quarter ended on 31st December 2020 filed with the Stock Exchanges under Regulation - 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the standalone quarterly results are available on the website of BSE Ltd. (www.bseindia.com) and the Company's website (www.tulaseebio.com)
- The financials have been prepared in accordance with Companies (Indian Accounting Standards) Rules 2015 IND-AS to the extent applicable. The Company has adopted IND-AS beginning 01st April, 2017 with transition date 01st April, 2016.
- The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 10.02.2021.

By Order of the Board of Directors
 For Tulasee Bio-Ethanol Ltd.
 Sd/-
Kapil Nagpal
 (Director)
 DIN: 01929335

Date : 10.02.2021
 Place : Raigad

RUDRABHISHEK ENTERPRISES LIMITED

CIN: L74899DL1992PLC050142
 Registered Office: 820, Antriksh Bhawan, K.G Marg, New Delhi-110001
 Email: secretarial@replurbanplanners.com, Website: www.repl.global

STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2020

(Rs. In Lakhs)

Sr. No.	Particulars	Standalone		Consolidated	
		Quarter Ended	Nine Months	Quarter Ended	Nine Months
		31.12.2020	31.12.2019	31.12.2020	31.12.2019
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
		(Limited)	(Management Certified)	(Limited)	(Management Certified)
		Reviewed	Reviewed	Reviewed	Reviewed
1	Total Income from operations	1,974.30	1,361.05	4,100.93	2,130.25
2	Net Profit from ordinary activities after tax	421.32	274.42	620.22	415.32
3	Net Profit for the period after tax (after Extraordinary items)	421.32	274.42	620.22	415.32
4	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	422.93	273.23	625.05	416.65
5	Equity paidup share capital	1,734.25	1,734.25	1,734.25	1,734.25
6	Earnings per share (Not annualised) :				
	Basic (₹)	2.43	1.58	3.58	2.37
	Diluted (₹)	2.43	1.58	3.58	2.37

Notes:

- The above results were reviewed and recommended by the Audit Committee & approved by the Board of Directors at their respective meetings held on 10th February, 2021. The financial results for the quarter and Nine months ended December, 31st 2020 have been limited reviewed by the Statutory Auditors of the Company.
- The standalone and consolidated financial results have been prepared in accordance with the principles and procedures of Indian Accounting Standards ("Ind AS") as notified under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as specified in Section 133 of the Companies Act, 2013.
- The Consolidated Financial Results of the company and its Foreign Subsidiary/Indian subsidiary (Group) have been prepared as per Ind AS 110 "Consolidated Financial statements". The following entities have been considered in Consolidated quarterly and year to date financial statements. 1. Rudrabhishek Infosystem Private Limited - Wholly owned Subsidiary. 2. Rudrabhishek Singapore PTE - Subsidiary (Consolidated)
- The Company has adopted Ind AS from April 1, 2020 and accordingly, these financial results have been prepared in accordance with the recognition and measurement principles laid down in Ind AS 34 Interim Financial Reporting prescribed under section 133 of the Companies Act 2013, read with relevant rules issued thereunder. The date of transition to Ind AS is April 1, 2019. The impact of transition has been accounted for in the opening reserves and the comparative period results have been restated accordingly. The opening balance sheet as at April 1, 2019 and the results for the subsequent periods would be finalised and will be subject to audit at the time of annual financial statements for the year ending March 31, 2021. Reconciliation of Net Profit after tax as under Indian GAAP and Ind AS for the quarter and Nine months ended December 31, 2019 have not been given as the company had not published quarterly and nine months period ended December 31, 2019. Reconciliation of net profit after tax as per Indian GAAP and Ind AS for the year ended March 31st, 2020 will be subjected to audit at the time of annual financial statements for the year ending March 31st, 2021.
- As the Company got switched to Main Board of National Stock Exchange on December 14th, 2020, the Company is required to prepare its Standalone & Consolidated Financial Statements under Indian Accounting Standards prescribed u/s 133 of the Companies Act, 2013. Effective 1st April 2019, the Company adopted Ind AS 116 "Leases" and applied the same to all Lease contracts existing on 1st April 2019 using modified retrospective method and has taken the cumulative adjustments to Retained Earnings on the date of initial application. Accordingly, the Comparative Figures of Previous periods have not been restated. The cumulative effect of application of standard has reduced the retained earnings by Rs. 4.36 Lacs (Net of deferred tax Asset) on transition date i.e. 01st April 2019. In the statement of Profit and Loss for the current period, the nature of expenses in respect of operating lease has changed from lease rent in previous periods to depreciation cost for right of use asset and Finance cost for interest accrued on lease liability. The adoption of new standard has resulted in recognition of Right of Use Rs. 242.50 lacs and lease liability of Rs. 248.33 Lacs on 01.04.2019.
- The company was listed with National Stock Exchange - SME Emerged platform and subsequently got listed in Main Board effective from December 14th, 2020. As per SEBI (Listing obligations and Disclosure requirements) Regulations 2015 as amended, till September 30th, 2020 the company was required to publish Half yearly unaudited Standalone and Consolidated Financial results as against quarterly unaudited Standalone and Consolidated Financial Statements. Accordingly, for the period 1st October 2020 to 31st December 2020, the company has prepared quarterly and for the 9 months period ended December 31st, 2020 as first quarterly Financial Statements. Since these are the first quarterly unaudited Standalone and Consolidated Financial results post listing switch over to Main Board of National Stock Exchange, the corresponding Consolidated results for the quarter ended December 31st, 2019, 9 months period ended December 31st 2019 and quarter ended September 30th, 2020 are not available, hence not published. The standalone unaudited financial results for the quarter ended September 30th, 2020, quarter ended December 31st, 2019 and 9 months period ended December 31st, 2019 are management certified and have not been subjected to limited review.
- In line with the provisions of Ind AS 108 - Operating Segments and on the basis of review of operations being done by the management of the Company, the operations of the company falls under advisory & Consulting, which is considered to be the only reportable segment by the management.
- The standalone financial results for the quarter and nine months ended December 31st, 2019 are also Ind AS compliant. The management has exercised necessary due diligence to ensure that the standalone financial results give a true and fair view. This information has not been subjected to limited review or audit.
- The above is an extract of the detailed format of unaudited standalone and consolidated Quarterly Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited standalone and consolidated Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and on the company website www.repl.global

For Rudrabhishek Enterprises Limited
 Pradeep Misra
 Chairman
 DIN : 01386739

Place : New Delhi
 Date : 10th February, 2021

Keshav SHRI KESHAV CEMENTS AND INFRA LIMITED

[Formerly : Katwa Udyog Limited]

Registered Office : Jyoti Towers, 215/2, Karbhar Street, Nazar Camp, Vadgaon, Belgaum - 590 005.
 Ph.: 0831 - 2483510, 2484412. CIN NO. L26941KA1993PLC014104
 Email: info@keshavcement.com, Website : www.keshavcement.com

EXTRACT OF THE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED DECEMBER 31, 2020

(In Lakhs)

Sl. No.	Particular	Quarter ended	Quarter ended	Quarter ended	Nine months ended	Nine months ended	Year ended
		31.12.2020	30.09.2020	31.12.2019	31.12.2020	31.12.2019	31.03.2020
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Un-audited)	(Un-audited)	(Audited)
1	Total income from operations	2296.05	1764.36	1613.53	5490.72	5097.11	6851.38
2	Net Profit / (Loss) for the period before tax (before exceptional and /extraordinary items)	(214.35)	(336.48)	(154.68)	(658.66)	(94.99)	(187.24)
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional / extraordinary items)	(214.35)	(336.48)	(154.68)	(658.66)	(94.99)	(187.24)